

M.Com (New) Semester - 2 (CBCS) Examination
May/June-2022 (NEW COURSE)
Corporate Financial Reporting(CORE (New))

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

પ્રશ્ન.૧ રાકેશ લિ. નાં 31-03-2021 અને 31-03-2022 નાં રોજનાં સરવૈયા નીચે મુજબ છે. (૨૦)

જવાબદારીઓ	31-3-21 રૂ.	31-3-22 રૂ.	મિલકતો	31-3-21 રૂ.	31-3-22 રૂ.
ઇક્વિટી શેરમૂડી	5,00,000	6,30,000	જમીન	1,96,000	1,80,000
પ્રેફરન્સ શેરમૂડી	1,00,000	2,70,000	મકાન	2,00,000	4,70,000
સામાન્ય અનામત	1,00,000	1,89,000	પ્લાન્ટ	1,90,000	3,60,000
નફા નુકશાન ખાતું	80,000	1,35,000	ફર્નિચર	62,000	70,000
12%ની તારણવાળી લોન	1,80,000	1,80,000	રોકાણો	1,20,000	1,20,000
લેણદારો	1,00,000	2,52,000	આખર સ્ટોક	1,80,000	2,43,000
ખર્ચ બાકી દેવાં	20,000	63,000	દેવાદારો	1,44,000	2,70,000
સૂચિત ડિવિડન્ડ	50,000	36,000	લેણીફૂંડી	48,000	-
આવકવેરા જોગવાઈ	70,000	45,000	રોકાડાબેંક	60,000	87,000
	12,00,000	18,00,000		12,00,000	18,00,000

ઉપરોક્ત સરવૈયાને સામાન્ય માપનાં સરવૈયા સ્વરૂપે રજુ કરી, 31-3-22નાં વર્ષમાં થયેલ મહત્વનાં ફેરફારો પર ચર્ચા કરો.

અથવા

પ્રશ્ન.૧ નીચેનાં આંકડાઓ અને ગુણોત્તરો પરથી રાધા લિ.નું વેપાર ખાતું ન.નું ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરો.

1. શેરમૂડી રૂ. 7,20,000
2. કાર્યશીલ મૂડી રૂ. 2,52,000
3. બેંક ઓવરડ્રાફ્ટ રૂ. 40,000

અવાસ્તવિક મિલકતો નથી. ચાલુ મિલકતોમાં સ્ટોક, દેવાદારો અને રોકડનો સમાવેશ થાય છે.

શરૂઆતનાં સ્ટોક કરતાં આખરનો સ્ટોક 20% વધુ છે.

1. ચાલુ ગુણોત્તર 2.5
2. ઝડપી ગુણોત્તર 1.5
3. સ્ટોક ગુણોત્તર 4 વખત
4. દેવાદાર ગુણોત્તર (વર્ષનાં 365 દિવસ ધ્યાનમાં લેવાં) 36.5 દિવસ
5. માલિકી ગુણોત્તર (કાયમી મિલકતો ÷ માલિકીનાં ભંડોળ) 0.7
6. કાચા નફાનો ગુણોત્તર 20%
7. ભરપાઈ મૂડી પર ચોખ્ખા નફાનો દર 10%

પ્રશ્ન.૨ મહેશ લિ. નું પાકુ સરવૈયું તથા નફા-નુકશાન ખાતું નીચે મુજબ છે. તા. 1-4-2021નાં રોજનું પાકુ સરવૈયું (રકમ હજારમાં)

(૨૦)

જવાબદારીઓ	રૂ	મિલકતો	રૂ
શેરમૂડી	40	પ્લાન્ટ-મશીનરી	60
12.5%નાં ડિબેન્ચર્સ	24	સ્ટોક	9
લેણદારો	14	દેવાદારો	5
		રોકડ	4
	78		78

તા. 31-3-2022 નાં રોજ પૂરા થતાં વર્ષનું નફા-નુકશાન ખાતું (રકમ હજારમાં)

વિગત	રૂ	વિગત	રૂ
શરૂઆતનો સ્ટોક	9	વેચાણ	40
ખરીદી	18	આખર સ્ટોક	8
કાચો નફો	21		
	48		48
વહિવટી ખર્ચ	3	કાચો નફો	21
ડિબેન્ચર વ્યાજ	3		
ઘસારો	6		
ચોખ્ખો નફો	9		
	21		21

વધારાની માહિતી:-

- વર્ષ દરમિયાન લેણદારો અને દેવાદારોની બાકીમાં ફેરફાર નથી.
- નીચેનાં સૂચક આંક ધ્યાનમાં લેવાં:-

1-4-2021	200
વર્ષ દરમિયાન સરેરાશ	240
31-3-2022 નાં રોજ	300
- Fifo પદ્ધતિ ધ્યાનમાં લેવી.

તા. 31-3-2022 નાં રોજનાં કિંમત તફાવતના હવાલા ધ્યાનમાં લઈ CPP પદ્ધતિ વાર્ષિક હિસાબો તૈયાર કરો.

અથવા

પ્રશ્ન.૨ તા. 31-3-2022 નાં રોજ પૂરા થતાં વર્ષ માટે રાજેશ લિ. નીચે આપેલ માહિતી પરથી ગિયરીંગ હવાલાની ગણતરી વર્તમાન પડતર હિસાબી પદ્ધતિ (CCA) મુજબ કરો.

વિગત	તા. 1-4-2021 રૂ.	તા. 31-3-2022 રૂ.
બેંક લોન	3,10,000	2,60,000
15% ના ડિબેન્ચર્સ	2,50,000	2,00,000
કરવેરાની જોગવાઈ	40,000	50,000
રોકડ અને બેંક	50,000	40,000
શેરમૂડી	10,00,000	10,00,000
અનામત અને વધારો	5,00,000	6,00,000
વર્તમાન પડતરના હવાલા:-		
વેચાણ પડતરનો હવાલો	રૂ. 1,20,000	
નાણાકીય કાર્યશીલ મૂડીનો હવાલો	રૂ. 80,000	
ઘસારાનો હવાલો	રૂ. 1,00,000	

પ્રશ્ન.૩ જયેશ કંપનીનાં નીચેનાં આવક-ખર્ચ પત્રક પરથી મૂલ્યવૃદ્ધિનું પત્રક તૈયાર કરો.

(૧૫)

વિગત	રૂ.	રૂ.
વેચાણ	32,00,000	
અન્ય આવકો	<u>6,00,000</u>	38,00,000
બાદ:		
માલસામાન પડતર	8,00,000	
મજૂરી	6,00,000	
વીમો પ્રિમિયમ	1,00,000	
ઓડિટ ફી	40,000	
સ્ટેશનરી	10,000	
વીજળી ખર્ચા	1,20,000	
ભાડું	10,000	
મુસાફરી ખર્ચા	20,000	
ઘસારો	1,10,000	
વ્યાજ	<u>90,000</u>	<u>19,00,000</u>
		19,00,000
બાદ:		
કરવેરા	8,00,000	
મૂલ્યવૃદ્ધિ કર	<u>1,00,000</u>	<u>9,00,000</u>
કર બાદનો નફો		10,00,000
બાદ:		
ઇક્વિટી ડિવિડન્ડ		<u>4,00,000</u>
રાખી મૂકેલ કમાણી		6,00,000

અથવા

પ્રશ્ન.૩ આર્થિક મૂલ્યવૃદ્ધિ અને બજારમૂલ્ય વૃદ્ધિ વિશે સમજાવો.

પ્રશ્ન.૪ કંપનીલક્ષી નાણાકીય અહેવાલપ્રેષણનો અર્થ અને હેતુઓ સમજાવો.

(૧૫)

અથવા

પ્રશ્ન.૪ નાણાકીય અહેવાલપ્રેષણ માહિતીનું ગુણવત્તાયુક્ત લાક્ષણિકતાઓ સમજાવો.

ENGLISH VERSION

Q.1 Following is the balance sheet of Rakesh Limited as on 31-03-2021 and 31-03-2022. (20)

Liabilities	31-3-21 Rs.	31-3-22 Rs.	Assets	31-3-21 Rs.	31-3-22 Rs.
Equity share capital	5,00,000	6,30,000	Land	1,96,000	1,80,000
Preference share capital	1,00,000	2,70,000	Building	2,00,000	4,70,000
General reserve	1,00,000	1,89,000	Plant	1,90,000	3,60,000
Profit & Loss A/c	80,000	1,35,000	Furniture	62,000	70,000
12% secured loan	1,80,000	1,80,000	Investments	1,20,000	1,20,000
			Closing stock	1,80,000	2,43,000
Creditors	1,00,000	2,52,000	Debtors	1,44,000	2,70,000
Unpaid Expenses	20,000	63,000			
			Bills Receivable	48,000	-
Proposed Dividend	50,000	36,000			
			Cash & bank	60,000	87,000
Provision for tax	70,000	45,000			
	12,00,000	18,00,000		12,00,000	18,00,000

Prepare common size balance sheets and comment upon the significant changes that have taken place during the year 31-3-2022

OR

Q.1 From the following figures and ratios prepare trading and profit and loss account and balance sheet of Radha Ltd.

1. Share capital Rs.7,20,000

2. Net working capital Rs.2,52,000

3. Bank overdraft Rs.40,000

There is no any fictitious assets. Current assets include closing stock, debtors and cash only. Closing stock is 20% more than the opening stock.

1. Current Ratio 2.5

2. Liquidity Ratio 1.5

3. Stock Ratio 4 times

4. Debtor's Ratio 36.5 days (consider 365 days of the year)

5. Ownership Ratio (permanent Assets/owners fund) 0.7

6. Gross profit Ratio 20%

7. Rate of net profit on paid up share capital 10%

Q.2 Following is the balance sheet and profit and loss account of Mahesh Ltd. (20)

Balance sheet as at 1-4-2021 (Rs. In Thousand)

Liabilities	Rs.	Assets	Rs.
Share capital	40	Plant-Machinery	60
12.5% debentures	24	Stock	9
Creditors	14	Debtors	5
		Cash	4
	78		78

Profit and loss Account for the year ended on 31-3-2022 (Rs. In Thousand)

Particular	Rs.	Particular	Rs.
To opening stock	9	By sales	40
To purchase	18	By closing stock	8
To gross profit	21		
	48		48
To administration exps.	3	By gross profit	21
To interest on debenture	3		
To depreciation	6		
To net profit	9		
	21		21

Additional Information:

1. There is no change in debtors and creditors balance during the year.
2. Following index are to be used.

On 1-4-2021	200
Average during the year	240
On 31-3-2022	300
3. Fifo method to be used

You are required to prepare final account for the year ended on 31-3-2022. After adjusting price level change under CPP method.

OR

- Q.2 Calculate the gearing adjustment under current cost Accounting (CCA) method of Rajesh Ltd. for the year ended on 31-3-2022.

Particular	01-4-2021 (Rs.)	31-3-2022 (Rs.)
Bank loan	3,10,000	2,60,000
15% Debentures	2,50,000	2,00,000
Provision for tax	40,000	50,000
Cash and bank	50,000	40,000
Share capital	10,00,000	10,00,000
Reserves and surplus	5,00,000	6,00,000

Adjustment of current cost:-

	Rs.
1. Cost of sales Adjustment (COSA)	1,20,000
2. Monetary working capital Adjustment	80,000
3. Adjustment of Depreciation	1,00,000

- Q.3 From income-Expenses statement of Jayesh Co. Ltd. prepare valued Added Statement. (15)

Particulars	Rs.	Rs.
Sales	32,00,000	
Add: Income from Services	<u>6,00,000</u>	38,00,000
Less:-		
Cost of materials	8,00,000	
Labour	6,00,000	
Insurance premium	1,00,000	
Audit fees	40,000	
Stationery	10,000	
Electricity Expenses	1,20,000	
Rent	10,000	
Travelling Expenses	20,000	
Depreciation	1,10,000	
Interest	<u>90,000</u>	<u>19,00,000</u>
		19,00,000
Less:		
Taxation	8,00,000	
Valued Added Tax	<u>1,00,000</u>	<u>9,00,000</u>
Profit after tax		10,00,000
Less: Equity Dividend		<u>4,00,000</u>
Retained Earning		6,00,000

OR

- Q.3 Explain about Economic Value added and market value added.

- Q.4 Explain the meaning and objectives of corporate financial Reporting. (15)

OR

- Q.4 Explain the qualitative characteristics of financial reporting information.
